

અરબી-ગુજરાતી

કુરઆને મજીદ

પારા-૨૩

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાચોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● [LIKE US ON FACEBOOK](#) ●

[HOME](#) | કુરઆને મજીદ (પારા-૨૩) -1 | [VISIT US](#)

નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે www.hajinaji.com પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

hajinajitrust@gmail.com

અનુક્રમણિકા

નં.	સૂરાનું નામ	પેજ
૩૬	સૂર-એ-યાસીન (આયત ૨૨ થી ૮૩)	૪
૩૭	સૂર-એ-સાફ્ફાત (આયત ૧ થી ૧૮૨)	૩૩
૩૮	સૂર-એ-સાદ (આયત ૧ થી ૮૮)	૯૦
૩૯	સૂર-એ-ઝોમર (આયત ૧ થી ૩૧)	૧૨૮

સુરો યાસીન / سورة يس

وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٢٢﴾

(૨૨) અને મને શું થઈ ગયું છે કે જોણે મને પેદા કર્યો છે તેની હું ઇબાદત ન કરું ? જો કે તમો સર્વેનું પાછું ફરવું પણ તેનીજ તરફ થશે.

ءَ اتَّخِذُ مِنْ دُونِهَا إِلَهًا إِنَّ إِلَهًا لَدُنِّي الرَّحْمَنُ بِضُرٍّ لَا تُغْنِي عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنْقِذُونِ ﴿٢٣﴾

(૨૩) શું હું તેને મૂકી દઈ (બીજા) એવા માઅબૂદો બનાવી લઉં કે જો તે દયાળુ (અલ્લાહ) મને કાંઈ હાનિ પહોંચાડવા યાહે તો તેમની ભલામણ મારા

કાંઈજ કામમાં ન આવે, અને (વળી) તેઓ મને
છોડાવી પણ શકશે નહિ ?

إِنِّي إِذًا لَفِي ضَلَالٍ مُّبِينٍ ﴿٢٢﴾

(૨૪) એ સ્થિતિમાં તો હું ખુલ્લી ગુમરાહીમાં રહી
જઈશ.

إِنِّي آمَنْتُ بِرَبِّكُمْ فَاسْمِعُونِ ﴿٢٥﴾

(૨૫) માટે (અથ પયગમ્બરો!) સાંભળી લ્યો કે
બેશક હું તમારા પરવરદિગાર પર ઇમાન લાવ્યો
છું.

قِيلَ ادْخُلِ الْجَنَّةَ ط قَالَ يَلِيَّتْ قَوْمِي يَعْلمُونَ ﴿٢٦﴾

(૨૬) (આ ઉપરથી લોકોએ તેને પત્થરો મારીને મારી નાખ્યો ત્યારે) તેને (અલ્લાહ તરફથી) કહેવામાં આવ્યું કે તું આ જન્મમાં દાખલ થઈ જા; (જેથી) તેણે કહ્યું કે જો મારી કોમના લોકો પણ આ જાણી લેતે તો કેવું સારું થાત:

بِمَا غَفَر لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمَكْرَمِينَ ﴿٢٦﴾

(૨૭) કે મને મારા પરવરદિગારે ક્યા કારણે માફ કરીને માન પામેલાઓમાં દાખલ કરી લીધો.

وَمَا أَنْزَلْنَا عَلَى قَوْمِهِ مِنْ بَعْدِهِ مِنْ جُنْدٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنْزِلِينَ ﴿٢٧﴾

(૨૮) અને તે (ના મરણ) બાદ તેની કોમ ઉપર (અઝાબ આપવા માટે) અમોએ આસમાન પરથી

કોઈ લશ્કર ઉતાર્યું નહિ, અને ન (તે) ઉતારવાની
અમને કંઈ જરૂર હતી.

إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خُمُودُونَ ﴿٢٩﴾

(૨૯) તેમના માટે કેવળ એક (ઘોર) ગર્જના (બસ)
હતી કે તરતજ તેઓ બુઝાઈ (નાશ પામી)ને રહી
ગયા.

يَحْسِرَةٌ عَلَى الْعِبَادِ ۚ مَا يَأْتِيهِمْ مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ

يَسْتَهْزِءُونَ ﴿٣٠﴾

(૩૦) કેવો અફસોસ છે બંદાઓની હાલત પર, કે
તેમની પાસે કોઈ પણ રસૂલ એવો આવ્યો નહિ કે
જેની આ (લોકો)એ મજાક કરી ન હોય.

أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا
يَرْجِعُونَ ﴿٣١﴾

(31) शुं आ (लोको) अटलुंये विचारता नथी के
अमोअे तेमनी पूर्वे कंछ केटलीअे पेढीओनो अेवो
नाश करी नाअ्यो के (४ ह७) तेमनी पासे पाछी
इरीने आवी नथी?

وَإِنْ كُلُّ لَّيْمًا جَمِيعٌ لِّدَيْنِنَا مُحْضَرُونَ ﴿٣٢﴾

(32) पए आ तेओ बधा ४ अमारी समक्ष हाजर
करवामां आवशे.

وَآيَةٌ لَهُمُ الْأَرْضُ الْمَيْتَةُ ۖ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا
فَمِنْهُ يُكْفُونَ ﴿٣٣﴾

(33) અને મૃત્યુ પામેલી ભૂમિ પણ તેમના (સમજવા) માટે એક (પ્રત્યક્ષ) મોઅજિઓ છે, જેને અમે પુનઃ સજીવન (ફળદ્રુપ) કરી દઇએ છીએ, અને તેમાંથી જ અનાજ ઉત્પન્ન કરીએ છીએ કે જેમાંથી તેઓ ખાય છે.

وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّنْ نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجْرَتًا فِيهَا مِّنَ
الْعُيُونِ ۝٣٣

(34) અને તેમાં અમે ખજૂરના તથા દ્રાક્ષના બગીચા બનાવીએ છીએ, અને તેમાં (શીતળ જળના) ઝરણાં વહાવી દઇએ છીએ.

لِيَأْكُلُوا مِن ثَمَرِهِ ۗ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۗ أَفَلَا يَشْكُرُونَ ۝٣٤

(૩૫) કે જેથી આ (લોકો) તે ફળોમાંથી ખાય, અને (બેશક) આ (ફળો) તેમની જાત મહેનતથી બનાવેલાં નથી; છતાં પણ તેઓ આભાર માનતા નથી?

سُبْحٰنَ الَّذِيْ خَلَقَ الْاَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنْبِتُ الْاَرْضُ وَمِمَّنْ اَنْفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُوْنَ ﴿۳۶﴾

(૩૬) વખાણને પાત્ર છે તે (અલ્લાહ)ની જાત કે જેણે દરેક વસ્તુના જોડાં ઉત્પન્ન કર્યા છે, જે જમીનમાંથી ઉગે છે તેમાંથી, અને તેમના પોતાનામાંથી, અને તે વસ્તુઓમાંથી પણ કે જેમનું હજી સુધી તેમને જ્ઞાન નથી.

وَآيَةٌ لَهُمُ اللَّيْلُ ۖ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُمْ مُظْلِمُونَ ﴿٣٧﴾

(૩૭) અને તેમના માટે રાત્રિ પણ એક નિશાની છે, જેમાંથી અમે દિવસને ખેંચી કાઢીએ છીએ, પછી આ (લોકો) તદ્દન અંધારામાં રહી જાય છે :

وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَهَا ۗ ذَلِكَ تَقْدِيرُ الْعَزِيزِ
الْعَلِيمِ ﴿٣٨﴾

(૩૮) અને સૂર્ય (પણ એક નિશાની છે) જે તેના નિશ્ચિત સ્થાન તરફ ચાલ્યો જાય છે; આ એક મહા શક્તિમાન (અને) મહાજ્ઞાનિ (અલ્લાહ) તરફથી નિર્માણ છે.

وَالْقَمَرَ قَدَرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ ﴿٣٩﴾

(૩૯) અને ચંદ્રમા (પણ એક નિશાની છે), જેની અમોએ (અમૂક) મંઝીલો (સ્થિતિઓ) નક્કી કરી છે, અહીં સુધી કે તે (મહિનાની આખરે) પલટાઇને ખજૂરીની જૂની શાખાનું સ્વરૂપ ધારણ કરી લે છે.

لَا الشَّمْسُ يَنْبَغِي لَهَا أَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ط وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ ﴿٣٩﴾

(૪૦) ન સૂર્યની મજાલ છે કે તે ચંદ્રમાને પકડી પાડે, અને ન રાત્રિની મજાલ છે કે તે દિવસ કરતાં આગળ વધી જાય; અને સર્વ કોઇ (પોત પોતાના નિશ્ચિત) વર્તૂળમાં તર્યા કરે છે.

وَآيَةٌ لَهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلِكِ الْمَشْحُونِ ﴿٤٠﴾

(૪૧) અને તેમના માટે આ પણ એક નિશાની છે કે અમે તેઓની સંતતિને ભરેલા વહાણમાં સવાર કરીએ છીએ.

وَوَلَقْنَا لَهُمْ مِنْ مِثْلِهِ مَا يَرْكَبُونَ ﴿٤٢﴾

(૪૨) અને તેમના માટે એવાજ (બીજા પણ) વાહનો પેદા કર્યા છે કે જેમના પર આ (લોકો) સવાર થતાં રહે છે.

وَإِنْ نَشَاءُ نُغْرِقْهُمْ فَلَا يَصْرِحُوا لَهُمْ وَلَا هُمْ يُنْقذُونَ ﴿٤٣﴾

(૪૩) અને જો અમે ઇચ્છીએ તો તેમને ડૂબાડી દઈએ. પછી તેમનો ન કોઈ ફરિયાદ સાંભળનારો હોય, અને ન તેમને બચાવી લેવામાં આવે :

إِلَّا رَحْمَةً مِنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ ﴿٣٣﴾

(૪૪) સિવાય કે અમારી (તેમના પર) કૃપા થાય, અને એક ચોક્કસ સમય સુધી (તેમને વધુ) લાભ પહોંચે (એમ ધાર્યું હોય).

وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ ﴿٣٥﴾

(૪૫) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે તમે તમારા આગળથી અને પાછળથી ઘેરી રહેલી (આપત્તિ)થી ડરતા રહો કે કદાચને તમારા પર દયા કરવામાં આવે.

وَمَا تَأْتِيهِمْ مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا
مُعْرِضِينَ ﴿٣٣﴾

(૪૬) અને તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી આવેલી નિશાનીઓમાંથી એક પણ એવી નિશાની આવી નથી કે જેનાથી તેમણે મોંઢું ફેરવી લીધું ન હોય.

وَإِذَا قِيلَ لَهُمْ أَنْفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۖ قَالَ الَّذِينَ كَفَرُوا
لِلَّذِينَ آمَنُوا أَنْطَعِمُ مَنْ لَوْ يَشَاءُ اللَّهُ أَطَعَمَهُ ۖ إِنَّ أَنْتُمْ إِلَّا
فِي ضَلَالٍ مُّبِينٍ ﴿٣٤﴾

(૪૭) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે રોઝી તમને આપી છે તેમાંથી

(અલ્લાહની રાહમાં પણ) કાંઈક ખર્ચ કરો, ત્યારે નાસ્તિકો મોઅમીનો વિષે કહે છે કે શું અમે એવાને કાંઈ ખવડાવીએ કે જેને અલ્લાહ યાહતે તો પોતેજ ખવડાવી દેતે ? (આ બાબતમાં) તમે તો ખુલ્લા ભ્રમમાં છો.

وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدِ إِنْ كُنْتُمْ صَادِقِينَ ﴿٣٨﴾

(૪૮) અને આ પણ કહે છે કે જો તમે (તમારા દાવામાં) સાચા છો તો (કહો કે) એ વાયદો ક્યારે પૂરો થઈને રહેશે ?

مَا يَنْظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّبُونَ ﴿٣٩﴾

(૪૯) (અય રસૂલ !) તેઓ માત્ર એનીજ રાહ જુએ છે કે તેમને એક (ઘોર) ગર્જના આવી પકડે, અને તેઓ અંદરોઅંદર ઝઘડતા જ રહી જાય.

فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ ﴿٥٠﴾

(૫૦) જેથી તે સમયે તેઓ ન કાંઈ વસીયત કરી શકશે, અને ન પોતાના બાલબચ્ચાં પાસે પાછા આવી શકશે.

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُمْ مِنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنْسِلُونَ ﴿٥١﴾

(૫૧) અને (જ્યારે બીજી વખતે) સૂર ફૂંકવામાં આવશે ત્યારે તેઓ કબરોમાંથી તત્કાળ નીકળી

(પડી) પોતાના પરવરદિગારની હજૂરમાં હાજર થવા માટે ઉતાવળા ઉતાવળા ચાલવા માંડશે.

قَالُوا يَوْمَئِذٍ لَّيْسَ بَيْنَنَا وَمَنْ بَعَثْنَا مِنْ مَّرْقِدِنَا^ط هَذَا مَا وَعَدَ الرَّحْمَنُ
وَصَدَقَ الْمُرْسَلُونَ ﴿٥٢﴾

(પર) (અને સ્વગત) કહેતા હશે કે હાય અફસોસ! અમને અમારા શયનગૃહો (કબરો)માંથી કોણે જાગૃત કર્યા ? (જવાબ આપવામાં આવશે કે) આ એજ સમય છે કે જેનો દયાળુ (અલ્લાહ)એ વાચદો કર્યો હતો, અને રસૂલો એ પણ સાચુંજ કહ્યું હતું.

إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَوَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَدَيْنَا
مُحْضَرُونَ ﴿٥٣﴾

(૫૩) માત્ર એકજ ગર્જના હશે કે તેઓ સર્વ તત્કાળ
અમારી હજૂરમાં હાજર કરી દેવામાં આવશે.

فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنْتُمْ
تَعْمَلُونَ ﴿٥٣﴾

(૫૪) ત્યારે તે દિવસે ન કોઈ વ્યક્તિ પર કાઠ
ઝુલ્મ કરવામાં આવશે, અને ન તેમની કરણીઓ
ઉપરાંત કોઈ (બીજો) બદલો આપવામાં આવશે.

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغْلٍ فُكِهُونَ ﴿٥٥﴾

(૫૫) બેશક સ્વર્ગવાસીઓ તે દિવસે
(મનોરંજનના) કાર્યોમાં મચેલા હશે.

هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلِّ عَلَى الْأَرَائِكِ مُتَّكِنُونَ ﴿٥٦﴾

(૫૬) તેઓ તથા તેમની પત્નીઓ (શીતળ) ઇયામાં સિંહાસનો પર ઓશીકાંઓને અઢેલી બેઠાં હશે.

لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُمْ مَّا يَدَّعُونَ ﴿٥٦﴾

(૫૭) તેમના માટે તે (સ્વર્ગ)માં દરેક (પ્રકારનો) મેવો અને તે દરેક વસ્તુ કે જે તેઓ ઇચ્છશે હાજર હશે.

سَلَامٌ قَوْلًا مِّن رَّبِّ رَجِيمٍ ﴿٥٧﴾

(૫૮) સલામ, દયાળુ પરવરદિગાર તરફથી (તેમના માટે) આ (સત્કારનો બોલ) હશે.

وَأَمَّا زَوْا الْيَوْمَ أَيُّهَا الْمَجْرُمُونَ ﴿٥٨﴾

(૫૯) (જહન્નમીઓને કહેવામાં આવશે કે) અય
ગુનેહગારો! આજના દિવસે તમે (સ્વર્ગવાસીઓથી)
જુદા થઈ જાઓ.

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَبْنَئِي آدَمَ أَنْ لَا تَعْبُدُوا الشَّيْطَانَ ۗ إِنَّهُ
لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ﴿٥٩﴾

(૬૦) અય આદમની ઓલાદ ! શું મેં તમને આ
હુકમ આપ્યો ન હતો કે (ખબરદાર !) શેતાનની
ઇબાદત કરશો નહિ? બેશક તે તમારો ખુલ્લો
દુશ્મન છે:

وَأَنْ اعْبُدُونِي ۗ هَذَا صِرَاطٌ مُسْتَقِيمٌ ﴿٦٠﴾

(૬૧) અને આ (હુકમ કર્યો હતો) કે મારીજ ઇબાદત કરજો; (કેમ કે) આજ સીધો માર્ગ છે.

وَلَقَدْ أَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِيرًا أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ ﴿٦١﴾

(૬૨) અને તેણે ખરેખરજ તમારામાંથી ઘણા લોકોને ગુમરાહ કરી નાખ્યા છે, તે છતાં તમે શું સમજતા નથી?

هَذِهِ جَهَنَّمُ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ ﴿٦٢﴾

(૬૩) હવે આ એજ જહન્નમ છે કે જેનો તમને વાયદો આપવામાં આવ્યો હતો.

إِصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ ﴿٦٣﴾

(૬૪) હવે તમે નાસ્તિકપણું કરતા હતા તે કારણે
આજે તેને જઇ ભેટો.

الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ
أَرْجُلُهُمْ بِمَا كَانُوا يَكْسِبُونَ ﴿٦٥﴾

(૬૫) તે દિવસે અમે તેમના મોંઢાં પર મહોર મારી
દઈશું, અને તેમના હાથ (વાચાળ બની) અમને
(સઘળી) વાતો કહી દેશે, અને તેમના પગો પણ
તેઓ જે જે કાંઈ કમાણી કરતા હતા તેને લગતી
જુબાની આપશે.

وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّى
يُبْصِرُونَ ﴿٦٦﴾

(૬૬) અને જો અમે યાહતે તો તેમની આંખોનું
પણ જરૂર કાસળ કાઢી નાખતે, પછી તેઓ માર્ગ
તરફ દોડવા માંડતે, પણ તેઓ કેમ જોઈ શકતે ?

وَلَوْ نَشَاءُ لَمَسَخْنَهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا
وَلَا يَرْجِعُونَ ﴿٦٦﴾

(૬૭) અને જો અમે ઇચ્છીએ તો તેઓ જ્યાં હોય
ત્યાં તેમના આકાર બદલી નાખીએ, પછી તેઓ ન
આગળ જઈ શકે, અને ન પાછા ફરીને આવી શકે.

وَمَنْ نُّعَبِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۗ أَفَلَا يَعْقِلُونَ ﴿٦٧﴾

(૬૮) અને જેને અમે વધારે આયુષ્ય આપીએ
છીએ તેને (શરીર) રચનામાં જૂકાવી દઇએ છીએ;
છતાં તેઓ સમજતા નથી?

وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنْبَغِي لَهُ ۗ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ
مُّبِينٌ ﴿٦٩﴾

(૬૯) અને અમોએ તે (રસૂલ)ને કાવ્ય નથી
શીખવ્યું, અને ન તેને તેની જરૂર છે; આ તો કેવળ
નસીહત અને સ્પષ્ટ કુરઆન છે:

لِيُنذِرَ مَنْ كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكٰفِرِيْنَ ﴿٧٠﴾

(૭૦) કે જેથી તે લોકો કે જેઓ ઝિન્દા (દિલ) છે તેમને ડરાવે, અને (સત્યનો) ઇન્કાર કરનારાઓ પર સત્ય વચન પૂરવાર થઇ જાય.

أُولَٰئِكَ يَرَوُوكَ أَنَا خَلَقْنَا لَهُمْ مِمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا
مٰلِكُونَ ﴿٤١﴾

(૭૧) શું તેઓ નથી જોતા કે જે પશુઓ અમોએ તેમના (લાભ) માટે પેદા કર્યા છે તે અમારા હાથેજ બનાવેલાં છે, પછી તેઓ તેમના માલિક થઇ બેસે છે ?

وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ ﴿٤٢﴾

(૭૨) અને અમોએજ તે (પશુ)ઓને તેમનાં આજ્ઞાધીન બનાવી દીધાં છે, પછી તે માંના કેટલાક તો તેમની સવારીઓ (માટે) છે, અને તે માંના કેટલાકોને તેઓ ખાય છે.

وَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبٌ أَفَلَا يَشْكُرُونَ ط

(૭૩) અને તેમના માટે આ પશુઓમાં (બીજા પણ ઘણાં) લાભો અને પીવાની વસ્તુઓ છે; છતાં શું તેઓ આભાર નહીં માને ?

وَاتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنصَرُونَ ط

(૭૪) અને તેમણે અલ્લાહને છોડી દઇ બીજા માઅબૂદ બનાવી લીધા છે કે તેમની સહાય કરવામાં આવે.

﴿لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُنْدٌ مُّحَضَّرُونَ﴾

(૭૫) (પરંતુ) તેઓ તેમની જરા પણ મદદ કરી શકશે નહિ, ઉલ્ટું તેઓ (ને) તેમની સામે (વિરોધી) સૈન્ય તરીકે હાજર કરવામાં આવશે.

﴿فَلَا يَحْزُنُكَ قَوْلُهُمْ ۗ إِنَّآ نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ﴾

(૭૬) માટે (અથ રસૂલ !) તેમની વાતો તને ઉદાસીનતામાં ન નાખે; જે જે કાંઈ તેઓ સંતાડે છે અને જે કાંઈ તેઓ જાહેર કરે છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ.

أَوَلَمْ يَرَ الْإِنْسَانُ أَنَّا خَلَقْنَاهُ مِنْ نُطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُبِينٌ ﴿٤٤﴾

(૭૭) શું મનુષ્ય એટલું પણ નથી જોતો કે ખરેજ અમોએ તેને વીર્યબિંદુથી પેદા કર્યો છે ? પછી તે અચાનક ખુલ્લી રીતે અમારો મુકાબલો કરનાર બની જાય છે.

وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ط قَالَ مَنْ يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ ﴿٤٥﴾

(૭૮) અને તે અમારા જ માટે દાખલો આપવા લાગે છે, અને પોતાની પેદાઈશ વીસરી જાય છે;

(અને) કહેવા લાગે છે કે માટી થઈ ગયેલી સ્થિતિવાળા હાડકાંઓને કોણ સજીવન કરી દેશે?

قُلْ يُحْيِيهَا الَّذِي أَنْشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ ﴿٧٩﴾

(૭૯) (અથ રસૂલ!) તું કહે કે તેમને એજ સજીવન કરી દેશે કે જેણે તેમને પ્રથમ વાર પેદા કર્યા; અને તે દરેક વસ્તુના સર્જનથી સંપૂર્ણ વાકેફ છે:

الَّذِي جَعَلَ لَكُمْ مِنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنْتُمْ مِّنْهُ تُوقَدُونَ ﴿٨٠﴾

(૮૦) જેણે તમારા માટે લીલા વૃક્ષોમાંથી આગ પેદા કરી દીધી કે જેથી તમે તે વડેજ (દેવતા) સળગાવતા રહો છો.

أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ بِقَدِيرٍ عَلَىٰ أَنْ يَخْلُقَ
مِثْلَهُمْ ۗ بَلَىٰ ۗ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ ﴿٨١﴾

(૮૧) શું તે કે જેણે આસમાનો તથા જમીનને પેદા કર્યા છે તે આ વાત પર કાબૂ નથી ધરાવતો કે તેમના જેવા બીજા પણ પેદા કરી દે ? ખરેખરજ કાબૂ ધરાવે છે; અને તેજ મહાન સર્જનહાર (અને) જ્ઞાની છે.

إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ ﴿٨٢﴾

(૮૨) (આ માત્ર તેનીજ શાન છે કે) જ્યારે તે કોઈ વસ્તુ (ઉત્પન્ન કરવા)નો ઇરાદો કરે છે તો તેને માત્ર એટલુંજ ફરમાવે છે કે "થા" કે તે (તત્કાળ) થઈ જાય છે.

فَسُبْحٰنَ الَّذِيْۤ اٰتٰنَا هٰذَا مِنْۢ بَيْنِ يَدَيْهِۭ مَلَكُوۡتٌۭ كُلِّۭ شَيْۡءٍۭ وَّاِلَيْهِۭ تُرْجَعُوۡنَ ﴿۸۲﴾

(૮૩) માટે પવિત્ર છે તે જાત કે જેના હાથમાં દરેક વસ્તુનો અધિકાર છે. અને તેનીજ હજૂરમાં તમો સઘળાઓનું પાછા ફરવાનું છે.

سورة الصفات / સૂરએ સાફ્ફાત

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી (શરૂ કરું છું) જે ઘણો મહેરબાન
(કૃપાળુ), બહુજ રહેમ (દયા) વાળો છે.

وَالصَّفِّ صَفًّا ①

(૧) કસમ છે વ્યવસ્થિત રીતે હારબંધ થઇને ઉભા
રહેનાર ફરિશ્તાઓની.

فَالزُّجْرَاتِ زُجْرًا ②

(૨) પછી કસમ છે તે ફરિશ્તાઓની કે જેઓ ધસી
જઇને (શેતાનોને) હાંકી કાઢે છે.

فَالثَّلِيثِ ذِكْرًا ③

(૩) પછી (કસમ છે) ઝિક (કુરઆન)ની તિલાવત કરનારાઓની.

إِنَّ الْهَكْمَ لَوَاحِدٌ ۝

(૪) કે બેશક તમારો માઅબૂદ એક જ છે.

رَبُّ السَّمَوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ ۝

(૫) આસમાનો તથા જમીન અને જે કાંઈ તેમની વચ્ચે છે તેમનો પાલનહાર છે, અને પૂર્વ દિશાઓનો માલિક છે.

إِنَّا زَيْنَا السَّمَاءِ الدُّنْيَا بِزَيْنَةٍ الْكَوَاكِبِ ۝

(૬) ખરેજ અમોએ આ જગતના આસમાનને તારાઓના શણગારથી શણગાર્યું છે:

وَحِفْظًا مِّنْ كُلِّ شَيْطَانٍ مَّارِدٍ ⑥

(9) અને દરેક બંડખોર શેતાન સામે (તેનું) રક્ષણ કર્યું છે.

لَا يَسْمَعُونَ إِلَى الْمَلَأِ الْأَعْلَى وَيُقَذَّفُونَ مِنْ كُلِّ جَانِبٍ ⑧

(૮) (જેથી) હવે તે (શેતાનો આસમાન) ઉપરના રહેવાસીઓની (વાતો) સાંભળી શકતા નથી અને દરેક બાજુથી (નાના મોટા તારા) તેમની તરફ ફેંકવામાં આવે છે.

دُحُورًا وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ ⑨

(૯) તેમને હાંકી કાઢવા માટે, અને આ તેમના માટે (હંમેશ) કાયમ રહેનારો અઝાબ છે.

إِلَّا مَنْ خَطَفَ الْحُطْفَةَ فَاتَّبَعَهُ شَهَابٌ ثَابِتٌ ⑩

(૧૦) સિવાય કે કોઈ શેતાન ઉડતી વાત લઈ નાસે તો પણ એક બાળીને ભસ્મ કરી નાખનારી જવાબા તેનો પીછો કરે છે.

فَأَسْتَفْتِهِمْ أَهْمُ أَشَدُّ خَلْقًا أَمْ مَنِ خَلَقْنَا إِنَّا خَلَقْنَاهُمْ

مِّنْ طِينٍ لَّا زِبٍ ⑪

(૧૧) માટે (અથ રસૂલ !) તેમને પૂછ કે સર્જનની રૂએ આ (લોકો)નું પયદા કરવું મુશ્કેલ છે કે જે અમોએ નિર્માણ કરી છે તે (ઉપર જણાવેલી વસ્તુઓ)નું; ખરેખરજ અમોએ તેમને ચીકણી માટીમાંથી ઉત્પન્ન કર્યા છે.

بَلْ عَجَّبْتَ وَيَسْخَرُونَ ﴿١٢﴾

(૧૨) વાત આ છે કે તને તો (તેમના ઇન્કારથી) આશ્ચર્ય થાય છે અને તેઓ હસતાજ રહે છે.

وَإِذَا دُكِّرُوا لَا يَذْكُرُونَ ﴿١٣﴾

(૧૩) અને જ્યારે તેમને ઉપદેશ આપવામાં આવે છે ત્યારે પણ તેઓ ઉપદેશ ગ્રહણ કરતા નથી.

وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ ﴿١٤﴾

(૧૪) અને જ્યારે કોઈ મોઝજિઓ નીહાળે છે ત્યારે તે પણ હાંસીમાં ઉડાડી દે છે.

وَقَالُوا إِن هَذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ﴿١٥﴾

(૧૫) અને કહે છે કે આ તો ખુલ્લો જાદુ છે.

ءَاذًا مِّمَّنَّا وَكُنَّا تُرَابًا وَعِظَامًا ؕ اِنَّا لَمَبْعُوثُونَ ﴿١٦﴾

(૧૬) શું જ્યારે અમે મરી જઇશું અને માટી તથા હાડકાં બની જઇશું તો પછી પણ ખરેખર ઉઠાડવામાં આવીશું ?

اَوْ اَبَاؤُنَا الْاَوَّلُونَ ﴿١٧﴾

(૧૭) અથવા અમારા આગલા બાપદાદાઓને પણ (ઉઠાડવામાં આવશે) ?

قُلْ نَعَمْ وَاَنْتُمْ دَاخِرُونَ ﴿١٨﴾

(૧૮) (અય રસૂલ !) તું કહે કે હા, (અલબત્ત ઉઠાડવામાં આવશો અને એવી રીતે) તમે સર્વે હીણપત ભરેલી દશામાં હશો.

